

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૦૮/૨૦૧૭ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૬૨૪/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૬ કેસ કરી, ૪૩ વ્યક્તિઓને ઝડપી, ૫૮ લીટર દેશી દારૂ, ૧૭૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૨ બીયર ટીન, ૦૧ સ્કુટર અને ૦૨ ઓટોરીક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૬ કેસ કરી ૩૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૫,૯૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૬૨૫/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૧૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૬૨૬/૧૭

સરદારનગર : સંજયભાઈ રમેશલાલ ધનવાણી (ઉ.વ.૨૨)(રહે,દ્વારકાનગર નોબલનગર નાના ચિલોડા રોડ સરદારનગર) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૦૮/૧૭ નાં કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે સંજયભાઈનાં પિતા રમેશલાલ ધર નજીકથી પોતાનું એકટીવા સ્કુટર ચલાવી પસાર થતાં હતા દરમિયાન એક અજાણ્યા ટ્રક ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી લાવી, રમેશલાલને ટક્કર મારી જીવલેણ ઇજાઓ કરી તેમનું મૃત્યુ નીપજાવી નાસી ગયો હતો. આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી પરષોત્તમભાઈ નારણભાઈ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૬૨૭/૧૭

ગાયકવાડ હવેલી : શંકર ગૌતમ પંચાલ (ઉ.વ.૪૫)(રહે.વિક્ટોરીયા ગાર્ડન કુટપાથ ઉપર રાયખડ) એ બીમારીથી કંટાળી જઈ તા.૧૧/૦૮/૧૭ ના કલાક ૪/૦૦ વાગ્યા પહેલાં કોઇપણ સમયે વિક્ટોરીયા ગાર્ડન પાસે બદામના ઝાડની ડાળીએ પ્લાસ્ટીકની દોરી બાંધી, ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી અબ્દુલઅજીજ અલીબક્ષ ચલાવે છે.

સરદારનગર : અજયભાઈ બાબુભાઈ અદાની (ઉ.વ.૧૮)(રહે, બળીયાદેવના છાપરા ભૈયાજીની ચાલી આઈ.ટી.આઈ. સામે નોબલનગર સરદારનગર) એ કોઈ અગમ્ય કારોણસર પોતાની જાતે પોતાનાં ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સરદારનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી જયેંદ્રસિંહ લાલસિંહ ચલાવે છે.

રામોલ : અમરતલાલ યાદવ (ઉ.વ.૩૦)(રહે,સઘરામ સોસાયટી, વસ્ત્રાલ) એ કોઈ અગમ્ય કારોણસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી રણજીતસિંહ છત્રસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.